

અમરેલી જિલ્લાના ચલાલા પો.રે.માં ચાર માસ પહેલા નોંધાયેલ અપહરણ તથા પોક્સોના અનડીટેક્ટ ગુનહાનો ભેદ ઉકેલી તેમાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી અપહ્યુતને મુક્ત કરાવતી સુરત શહેર એસ.ઓ.૯.

પોલીસ મહાનિદેશક સા.શ્રી સી.આઈ.ડી. ડાઇમ રેલ્વેઝ, ગુ.રા.,ગાંધીનગર તરફથી મહિલા વિરૂદ્ધ અત્યાચાર, બળાત્કાર, પોક્સો એક્ટ, છેડતી વિગેરે પ્રકારના ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે રૂપેશિયલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતુ. જે ડ્રાઇવ અંતર્ગત મહે.પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર સાહેબ સુરત શહેર નાઓએ સુરત શહેર તથા રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયેલ અપહરણ, બળાત્કાર અને પોક્સોના ગુનહાના આરોપીને પકડી પાડવા આવેલ સુચના અનુસાર એસ.ઓ.૯. ઢ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ રેટેશનના પો.ઇન્સ. શ્રી કે.સી.રાઠવા એ તેમના પોલીસ રેટેશનમાં ચાર માસ પહેલા અપહરણ અને પોક્સો હેઠળ નોંધાયેલ ગુનહામાં આરોપી તરીકે ફક્ત મોબાઈલ નંબરજ હોય અને તે મોબાઈલ નંબરનુ સુરત કનેક્શન હોવાનુ તપાસ દરમ્યાન જણાઈ આવેલ હોય. જેથી આ કામના આરોપી તથા અપહ્યુતને શોધી કાઢવા માટે સુરત શહેર પોલીસની મદદ માંગતા એસ.ઓ.૯. PI આર.એસ.સુવેરા નાઓએ ગુનહાની ગંભીરતા સમજી તુરત જ હરકતમાં આવી જઈ અમરેલી પોલીસ પાસેથી સદર ગુનહામાં સંડોવાયેલ આરોપી તેમજ ભોગ બનનારની તમામ પ્રકારની માહિતી એકત્ર કરી આ આરોપીને શોધી કાઢવા તથા તેના કબજામાંથી અપહ્યુતને હેમખેમ છોડાવવા માટે એસ.ઓ.૯.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી હુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

જેમા એસ.ઓ.૯.ના ASI ઇમ્તીયાઝભાઈ ફકરમોહમદ, તથા HC જગશી શાંતીલાલ નાઓને મળેલ બાતમી આધારે આરોપી જફર અસગર કુરેશી. ઉ.વ.૨૪ રહે. ઘર નં.૭૮૮, ચીમની ટેકરા ઝુપડપટ્ટી ૮૦ કુટના રોડ માનદરવાજા સુરત મુળ રહે. નાંદોરા, કુરેશી મહોલો, તા:નાંદોરા, જિ:બુલઢાણા, (મહારાષ્ટ્ર) વાળાને ઝડપી પાડેલ છે.

મજકુર આરોપી વિરૂદ્ધમાં ઘોરણસર કાર્યવાહી કરી આરોપી તથા અપહ્યુતને અમરેલી પોલીસને સોંપી આવેલ છે. શોધાયેલ ગુનહો :-

(૧) અમરેલી જિલ્લાના ચલાલા પો.રે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૧૦૨૬૩ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો કલમ ૧૮ મુજબ.